



AuSom Enterprise Limited

Ref. No.: AEL/SEC/STOCK/2022-23

Date: - 26th May, 2022

To,
The Manager, DCS-CRD
Corporate Relationship Department,
BSE Limited,
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Mumbai- 400 001

To,
The Listing Department, 5th Floor,
National Stock Exchange of India Limited,
"Exchange Plaza",
Bandra-Kurla Complex,
Bandra (East), Mumbai-400 051

SECURITY CODE: **509009** || SECURITY ID: **AUSOMENT** || ISIN: **INE218C01016** || SERIES: **EQ**

Dear Sir/Madam,

Sub.:- Newspaper Publication - Submission of the copy of the newspaper cutting of the extract of Audited Standalone and Consolidated Financial Results for the quarter and financial year ended 31st March, 2022.

As per Regulations 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper cutting of the extracts of Audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and financial year ended 31st March, 2022 which were published in English newspaper "THE INDIAN EXPRESS" and in Vernacular newspaper "FINANCIAL EXPRESS" on 26th May, 2022.

You are therefore requested to take note of the same.

Thanking you,

For, AuSom Enterprise Limited

Ravikumar Pasi
Company Secretary &
Compliance Officer



Encl: As Above

Correspondence Address : 606 "SWAGAT", Near Lal Bungalow,
C.G.Road, Ahmedabad-380 006. Phone : +91 79 2642 1422-1499
Fax : +91 79 2656 9898 E-mail : ausom.ael@gmail.com www.ausom.in

Registered Office : 11-B, New Ahmedabad Industrial Estate,
Sarkhej-Bavla Road, Village - Moraiya - 382 213
Dist. Ahmedabad, Gujarat, INDIA • CIN : L67190GJ1984PLC006746

Classifieds

PERSONAL

Change of Name

I have changed my old name from **Dodiya Bhagyesh Kanaiyalal** to New Name **Dodiya Bhagyeshkumar Kanaiyalal**
Address
56, Gopinath Park Society, Behind SRP Head Quaters, Near ST Workshop, Patiya, Sahijpur Bogha, Ahmedabad-382345

Change of Name

I have changed my name from **Kisan Lal Mundha** to New Name **Kishan Mundha**
Address
18, Safal Vivaan-Ph1, Nr. Gota Bridge, Gota, Ahmedabad-382481.

CHANGE OF NAME

I have Changed my Name **Rameshbhai Muljibhai Chauhan** to **Rameshchandra Muljibhai Chauhan.**
Address : 30, Jahanvi Bunglow, New C.G. Road, Nr. Sakar Road, Ahmedabad - 382424.

PROPERTY

For Sale / Rent in Pune Premium Offices 2,000 - 10,00,000 Sq.ft./ Luxury Apartments & Bungalows/ Industrial Land & Factories. Call/ WhatsApp:98230220 97 www.earthwell-realty.com
0050197256-1

"IMPORTANT"
Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

Notification Under Section-19(1) Revenue Department, Sachivalaya, Gandhinagar
(The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation & Resettlement Act, 2013 (No. 30 of 2013))

District : Panchmahal
No. AM-M-2022-210-LPN-2020-297-CH Date: 17 MAY 2022
Whereas it appears to the Government of Gujarat The Right to Fair compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement 2013 (30 of 2013) that the land specified in below SCHEDULE are required for public purpose viz. for **Constg. Mordungara Sampa Dharola Road.**
And whereas by Government of Guajrat, Revenue Department Notification no. **AM-2021-233-M-LPN-2020-297-CH** published according to law on **Dated 01/06/2021** It was notified that lands specified in the schedule hereto after referred as the lands are required for the public purpose and whereas the Government of Gujarat is satisfied after considering the report of Additional Special Land Acquisition Officer, Panchmahal, Godhra under section 15 of the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 (30 of 2013) that the said lands are needed to be acquired as per the schedule hereto.

It is hereby declared that under the provision of Section 19 of the said act that the lands admeasuring of **0-84-00 He-Are-Sq.mts. in Village Sampa, Taluka Godhra, District Panchmahal** are needed for the public purpose mentioned above.

As no family is getting displaced due to the subject land acquisition and therefore no resettlement area is required. Under Section 3(G) of the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 (30 of 2013) the Additional Special Land Acquisition Officer, Panchmahal, Godhra is here by appointed to perform the functions of the Collector for all proceeding here after to be taken in respect of the said land' acquisition.
A Plan of land may be inspected in the office of additional Special Land Acquisition Officer, Panchmahal, Godhra on any working day.

SCHEDULE			
Survey/ Block No.	Area (H.Are.Sq.Mtr.)	Survey / Block No.	Area (H.Are.Sq.Mtr.)
112/7	0-25-00	112/40	0-16-00
112/8	0-13-00	112/42	0-05-00
112/12	0-03-00	284/A	0-12-00
117	0-10-00	Total	0-84-00

By order and in the name of Governor of Gujarat
Sd/-
(H. J. Rathod)
Under Secretary
Revenue Department
Govt. of Gujarat
(INF/Godhra/181/2022)

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2022										
(RS. IN LAKHS)										
Particulars	STANDALONE					CONSOLIDATED				
	Quarter ended 31.03.2022	Quarter ended 31.12.2021	Quarter ended 31.03.2021	Year ended 31.03.2022	Year ended 31.03.2021	Quarter ended 31.03.2022	Quarter ended 31.12.2021	Quarter ended 31.03.2021	Year ended 31.03.2022	Year ended 31.03.2021
	Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
Total Income from Operations	2391.08	321.95	949.94	3407.46	47350.15	2348.54	321.95	949.94	3364.92	47350.15
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	71.08	56.72	(139.67)	652.72	2028.69	(95.91)	(23.60)	321.74	652.72	2028.70
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	71.08	56.72	(139.67)	652.72	2028.69	(95.91)	(23.60)	321.74	652.72	2028.70
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	62.08	44.72	(259.58)	536.72	1538.78	(104.91)	(35.60)	201.83	536.72	1538.78
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	62.36	44.72	(259.16)	537.00	1539.20	(104.63)	(35.60)	202.25	537.00	1539.20
Equity Share Capital (FV of Rs. 10/- each)	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36
Other Equity	---	---	---	10293.72	9756.71	---	---	---	10293.72	9756.71
Earnings Per Share (of Rs. 10/- each) (For continuing and discontinued operations) (not annualized)	0.46	0.33	(1.91)	3.94	11.29	(0.77)	(0.26)	1.48	3.94	11.29
Basic:	0.46	0.33	(1.91)	3.94	11.29	(0.77)	(0.26)	1.48	3.94	11.29
Diluted:	0.46	0.33	(1.91)	3.94	11.29	(0.77)	(0.26)	1.48	3.94	11.29

Note- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the stock exchange websites at www.bseindia.com, www.nseindia.com and company's website www.ausom.in.

Place: Ahmedabad
Date: 25/05/2022

For AUSOM ENTERPRISE LIMITED
KISHOR P. MANDALIA
MANAGING DIRECTOR

KEMISTAR CORPORATION LIMITED					
604, Manas Complex, Near Jodhpur Cross Road, Satellite, Ahmedabad - 380015, Gujarat. CIN: L24233GJ1994PLC022845 Email: kemistarbse@gmail.com Web: www.kemistar.in					
Extract of Audited Consolidated & Standalone Financial Results for the Quarter and year ended on March 31, 2022					
(Rs. In Lakhs Except EPS)					
Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2022	31.03.2021	31.03.2022	31.03.2021
1	Total Income from Operations	1128.29	604.85	2097.08	1410.59
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items#)	41.91	(11.51)	108.09	55.45
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional items#)	41.91	(11.51)	108.09	55.45
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items#)	29.24	(20.23)	83.92	44.29
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	29.24	(20.23)	83.92	44.29
6	Equity Share Capital	1075.94	1075.94	1075.94	1075.94
7	Reserves (excluding Revaluation Reserve)	0.00	0.00	0.00	0.00
8	Earnings Per Share of Rs.10/- each				
	1. Basic: (In Rs)	0.27	(0.19)	0.78	0.41
	2. Diluted: (In Rs)	0.27	(0.19)	0.78	0.41

NOTE: KEY STANDALONE FINANCIALS OF THE COMPANY IS AS UNDER

Sr. No.	Particulars	31.03.2022	31.03.2021	31.03.2022	31.03.2021
1	Total Income from Operations	340.4	310.82	644.54	625.79
2	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items#)	16.07	15.42	29.38	23.83
3	Net Profit/(Loss) for the period after tax (after Exceptional items#)	13.13	12.92	22.95	18.88

NOTE
a) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated financial result for the quarter and year ended on 31.03.2022 is available on the websites of www.bseindia.com and www.kemistar.in.
b) The above financials were reviewed by the audit committee and approved by the Board of Directors in the meeting held on May 25, 2022.
c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules /AS Rules, whichever is applicable.

For Kemistar Corporation Limited
Sd/-
Ketan Patel
Managing Director
(DIN No. 01157786)

Date: May 25, 2022
Place: Ahmedabad

TORRENT PHARMACEUTICALS LIMITED			
Registered Office: Torrent House, Off Ashram Road, Ahmedabad - 380 009, Gujarat, India. Ph. : + 91 79 26599000 Fax : + 91 79 26582100			
Extract of Consolidated Financial Results for the Quarter and Year ended 31-Mar-2022			
(₹ in crores except per share data)			
Particulars	Quarter Ended 31-Mar-2022	Year Ended 31-Mar-2022	Quarter Ended 31-Mar-2021
	Audited (Refer Note 2)	Audited	Audited (Refer Note 2)
Total Income from operations (net)	2131	8508	1937
Net Profit / (Loss) for the period before tax and exceptional items	398	1711	383
Net Profit / (Loss) for the period before tax and after exceptional items	(87)	1226	383
Net Profit / (Loss) for the period after tax and exceptional items	(118)	777	324
Total Comprehensive Income (after tax)	(107)	789	347
Equity Share Capital	84.62	84.62	84.62
Other Equity excluding Revaluation Reserve*		5868	
Earnings per share (of ₹ 5/- each)			
Basic	(6.98)	45.93	19.16
Diluted	(6.98)	45.93	19.16

* Other Equity excluding Revaluation Reserve as on 31-Mar-2021 was ₹ 5753 crores.

Notes :
1 Summary details of stand-alone audited financial results of Torrent Pharmaceuticals Limited :
(₹ in crores)

Particulars	Quarter Ended 31-Mar-2022	Year Ended 31-Mar-2022	Quarter Ended 31-Mar-2021
Net income from operations	1662	6742	1468
Profit before tax	345	1466	301
Profit after tax	221	991	279
Total Comprehensive Income (after tax)	219	992	302

2 The figures for the quarter ended 31-Mar-2022 and 31-Mar-2021 is the balancing figures between audited figures in respect of the full financial year and for the period upto the end of the third quarter of relevant financial year, which were subject to limited review.

3 The Board of Directors in their meeting held on 25-May-2022, recommended a final equity dividend of ₹ 8/- per equity share.
The Company is completing 50 years of its incorporation this year. To commemorate the same, the Board has additionally recommended :
1. A special dividend of ₹ 15/- per equity share. Considering this, the total dividend for year become ₹ 48/- per equity share (includes interim dividend of ₹ 25/- per equity share).
2. Bonus share issue in the ratio of 1:1 i.e. one equity bonus share for each fully paid up equity share. Consequent to the bonus issue, the total paid up share capital will be ₹ 169.22 crores from the existing ₹ 84.62 crores.

4 The above is an extract of the detailed format of Financial Results for the quarter and year ended 31-Mar-2022 filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same, along with the notes, are available on www.nseindia.com, www.bseindia.com and on the Company's website www.torrentpharma.com

Place : Ahmedabad, Gujarat
Date : 25-May-2022

NORRIS MEDICINES LIMITED				
CIN No.: L24230GJ1990PLC086581 Regd Off: 801/P, GIDC Estate, Ankleshwar, 393002, Gujarat Phone: 02646-223462 Fax: 02646-250126 Website: www.norrispharma.com Email: norrismedicines@gmail.com				
Extract of Audited Standalone Financial Results for the Quarter and Year ended 31st March, 2022				
(₹ in Lakhs)				
Particulars	Quarter Ended		Year Ended	
	31.03.2022	31.03.2021	31.03.2022	31.03.2021
Total income from operations (Net)	83.41	259.81	946.42	1230.07
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-115.39	-220.58	-218.45	-399.34
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-115.39	-220.58	-218.45	-399.34
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-223.29	-317.43	-326.35	-496.19
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-223.29	-317.43	-326.35	-496.19
Equity Share Capital	992.58	992.58	992.58	992.58
Reserves (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)	0.00	0.00	0.00	0.00
Earning per share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)				
Basic:	-2.23	-3.17	-3.26	-4.96
Diluted:	-2.23	-3.17	-3.26	-4.96

Note:
The above is an extract of the detailed format of Quarterly and yearly Standalone Audited Financial Results filed with the stock exchange under Reg. 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and Company's Website (www.norrispharma.com)

Place: Ankleshwar
Date: 25.05.2022

For Norris Medicines Limited
Sd/-
Vimal D. Shah
Managing Director

Aspire Home Finance Corporation Limited
Corporate Office: Motilal Oswal Tower, Rahimtulah Sayani Road, Opposite ST Depot, Prabhadevi, Mumbai-400025. **CIN Number :- U65923MH2013PLC248741**
Branch Office:- Office No. 1026, 1027 & 1028, 1st Floor, World Trade Centre, Nr. Udhna Darwaja, Ring Road, Surat - 395002, Gujarat
Branch Office:- Ashwamegh Elegance-3, 601-612, 6th Floor, Nehrunagar To CN School Road, Opp. SBI Zonal Office, B/H Grand Mall Ambavadi, Ahmedabad-380006, Gujarat
Contact No.:- Mr. Alpeshkumar Patel - 9372705599

PUBLIC NOTICE FOR E-AUCTION CUM SALE
Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorised Officer of Aspire Home Finance Corporation Limited (AHFCL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of amount due from borrower/s, offers are invited to submit online in the Web Portal of our Sales & Marketing and e-Auction Service Partner, M/s. Invention Solutions Pvt. Limited (Invention) i.e. <https://auctions.invention.in> by the undersigned for purchase of the immovable property, as described hereunder, which is in the Physical Possession on 'As Is Where Is Basis', 'As Is What Is Basis' and 'Whatever is There Is Basis', particular of which are given below:

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagors	Date & Amount of 13(2) Demand Notice	Description of Property	Reserve Price	Date & Time of e-Auction
			EMD Bid Increase Amount	
LAN: LXSUR00417-180055684 Branch: SURAT Borrower: RATANLAL SOHANLAL KHATIK Co-Borrower: POOJA RATANLAL KHATIK	19-12-2020 for Rs. 11,14,873/- (Rupees Eleven Lac Fourteen Thousand Eight Hundred Seventy Three Only)	Plot No - 436, Rs No - 144, Block No - 139, Shiv Sagor Residency - 2, Jolva, Mouje - Dastan, Palsana, Surat, Gujarat - 394327	Rs. 75,000/- Rs. 75,000/- Rs. 10,000/-	28th June, 2022 Time: 10.00 A.M. to 10.30 A.M.
LAN: LXNAR00317-180055024 Branch: NAROL Borrower: MAULIK RAMESHBHAI MOCHI Co-Borrower: TEJAL MAULIKBHAI MOCHI	28-01-2019 for Rs. 1914866/- (Rupees Nineteen Lac Fourteen Thousand Eight Hundred Sixty Only)	Flat No C/ 304 Sanidhaya 2 B/H Panchslok Residency, Near Akshay Residency, Tragad Chankheda - 380026 Ahmedabad Gujarat	Rs. 28,22,400/- Rs. 28,22,400/- Rs. 10,000/-	28th June, 2022 Time: 10.30 A.M. to 11.00 A.M.

- Terms and Conditions of E-Auction:**
1. The Auction is conducted as per the further Terms and Conditions of the Bid document and as per the procedure set out therein. Bidders may go through the website of Aspire Home Finance Corporation Limited (AHFCL), www.motilaloswalhfl.com and website of our Sales & Marketing and e-Auction Service Provider, <https://auctions.invention.in> for bid documents, the details of the secured asset put up for e-Auction and the Bid Form which will be submitted online;
2. All the intending purchasers/bidders are required to register their name in the Web Portal mentioned above as <https://auctions.invention.in> and generate their User ID and Password in free of cost of their own to participate in the e-Auction on the date and time aforesaid
3. For any enquiry, information & inspection of the property, support, procedure and online training on e-Auction, the prospective bidders may contact the Client Service Delivery (CSD) Department of our Sales & Marketing and e-Auction Service Partner M/s. Invention Solutions Pvt. Limited, through Tel. No.: +91 9137100020 & E-mail ID: care@invention.co.in or akshada@invention.co.in or the Authorised Officer, Mr. Alpeshkumar Patel - 9372705599
4. To the best of knowledge and information of the Authorised officer, there is no encumbrance in the properties/ies. However the intending bidders should make their own independent inquiries regarding the encumbrance, title of property/ies put up on e-Auction and claims/rights/affecting the property prior to submitting their bid. The e-Auction advertisement does not constitute any commitment or any representation of AHFCL. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to AHFCL. The Authorised officer/Secured Creditor shall not be responsible in any way for any third party claims/rights/dues;
5. For participating in the e-Auction, intending purchasers/bidders will have to submit/upload in the Web Portal (<https://auctions.invention.in>) the details of payment of interest-free refundable Earnest Money Deposit (EMD) of the secured asset as mentioned above by way of Demand Draft in favour of 'Aspire Home Finance Corporation Limited' or by way of RTGS/ NEFT to the account details mentioned as follows: Bank Name: HDFC Bank, Branch: Lower Parel Mumbai, Bank Account No.: 00600340073530, IFSC Code: HDFC00000660 along with self-attested copies of the PAN Card, Aadhaar Card, Residence Address Proof, Board Resolutions in case of company and Address Proof on or before 04:00 PM of 27/06/2022;
6. The Property will not be sold below the Reserve Price. The Successful Purchaser/ Bidder shall have to deposit the 25% (inclusive of EMD) of his/her offer by way of RTGS/NEFT to the account mentioned herein above within 24:00 hours from the completion of e-Auction, failing which the sale will be deemed have been failed and the EMD of the said Successful Bidder shall be forfeited;
7. The EMD of all other bidders who did not succeed in the e-Auction will be refunded by AHFCL within 72 working hours of the closure of the e-Auction. The EMD will not carry any interest
8. The balance amount of purchase consideration shall be payable by the Successful Purchaser/ Bidder on or before the fifteenth (15th) day from the date of 'Confirmation of Sale' of the said secured asset by the Authorised Officer/Secured Creditor or such extended period as may be agreed upon in writing by the Authorised Officer at his/her discretion. In case of default, all amounts deposited till then shall be liable to be forfeited;
9. Date of Inspection of the Immovable Property is on 02-06-2022 between 11.30 AM to 04.00 PM.
10. At any stage of the e-Auction, the Authorised Officer may accept/reject/modify/cancel the bid/offer or postpone the e-Auction without assigning any reason thereof and without any prior notice. In case any bid is rejected, Authorised Officer can negotiate with any of the rendered or intending bidders or other parties for sale of property by Private Treaty.
11. The Successful Purchaser/ Bidder shall bear any statutory dues, taxes, fees payable, stamp duty, registration fees, etc. that is required to be paid in order to get the property conveyed/delivered in his/her/its favour as per the applicable law;
12. Sale is subject to the confirmation by the Authorised Officer;
13. The Borrower/Guarantors, who are liable for the said outstanding dues, shall treat this Sale Notice as a notice under Rule 8(G) of the Security Interest (Enforcement) Rules about the holding of above mentioned auction sale;
14. The Borrower(s)/Guarantor(s) are hereby given 30 DAYS SALE NOTICE UNDER THE SARFASIACT, 2002 to pay the sum mentioned as above before the date of Auction failing which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to AHFCL, in full before the date of sale, auction is liable to be stopped.
15. The Total Loan Outstanding amount is not the loan foreclosure amount. All other charges (if any) shall be calculated at the time of closure of the loan.
16. AHFCL is not responsible for any liabilities whatsoever pending upon the property as mentioned above. The Property shall be auctioned on 'As Is Where Is Basis', 'As Is What Is Basis' and 'Whatever Is and 'no recourse' Basis'.
17. The sale shall be subject to rules/conditions prescribed under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, as amended from time to time. It shall solely be the responsibility of the Successful Bidder/ Purchaser to get the sale registered. All expenses relating to stamp duty, registration charges, transfer charges and any other expenses and charges in respect of the registration of the sale for the above referred property shall be borne by the Successful Bidder/ Purchaser. The sale has to be registered at the earliest else the purchaser has to give the request letter to AHFCL mentioning the reason of delaying the registration;
18. No person other than the intending bidder/ offerer themselves, or their duly authorised representative shall be allowed to participate in the e-Auction/sale proceedings. Such Authorisation Letter is required to submit along with the Bid Documents;
19. Special Instruction: e-Auction shall be conducted by the Service Provider, M/s. Invention Solutions Pvt. Limited on behalf of Aspire Home Finance Corporation Limited (AHFCL), on pre-specified date, while the bidders shall be quoting from their own home/ offices/ place of their bid as per their choice above the Reserve Price. Internet connectivity and other paraphernalia requirements shall have to be ensured by bidders themselves. Please note that failure of Internet connectivity (due to any reason whatsoever it may be) shall be sole responsibility of bidders and neither AHFCL nor Invention shall be responsible for these unforeseen circumstances. In order to ward-off such contingent situation, bidders are requested to make all the necessary arrangements/ alternatives whatever required so that they are able to circumvent such situation and still be able to participate in the e-Auction successfully. However, it is requested to the Bidder(s) not to wait till the last moment to quote/modify his/her bid to avoid any such complex situations.
20. The same has been published in our portal - <https://motilaloswalhfl.com/auction-pdf>
NB: Please note that the secured creditor is going to issue the sale notice to all the Borrowers/ Guarantors/ Mortgagors by speed/ registered post. In case the same is not received by any of the parties, then this publication of sale notice may be treated as a substituted mode of service.

Place : Gujarat
Date : 26-05-2022
Sd/-
Authorised Officer
Aspire Home Finance Corporation Limited

"IMPORTANT"
Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

